

PAR/CS/NSE/2025-26/38

To,
The Manager
Listing department,
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block-G,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai- 400 051
Maharashtra

Date:14/11/2025

Subject: Submission of Newspapers Cutting of published Standalone Un-Audited Financial
Results for the quarter & half year ended September 30, 2025

Ref.: **Symbol- PAR, ISIN: INE04LG01015**

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose the cuttings of newspaper advertisement published in Newspaper dated November 14, 2025 in The Economic Times (English) and Navgujarat Samay (Gujarati), regarding Un-Audited Financial Results for the quarter & half year ended September 30, 2025

Copies of newspapers cutting in this connection are attached herewith.

The above information is also available on the website of the Company www.pardrugs.com

Kindly take on the record and acknowledge the receipt.

Yours Faithfully

For PAR DRUGS AND CHEMICALS LIMITED

(Sanket B. Trivedi)**Company Secretary & Compliance Officer**

Keoti to Saharsa to Munger: 6 Seats That Never Miss the Wave

Kumar Anshuman

New Delhi: Six seats in the recently-concluded Bihar polls have proved to be bellwether seats as it will decide which alliance will form the next state government. The polls results for all 243 seats will be announced on Friday.

First on the list is Keoti assembly constituency in Madhubani district with a 100% track record of siding with the party that forms the government. Voters of Keoti have never gone wrong since 1977 when the Janata Party won the seat and formed the government. Congress won the seat twice in 1980 and 1985 and formed the state government. First, Janata Dal and then RJD won the seat thrice till 2000 and the party formed the government. In 2005 and 2010, BJP won the seat and NDA formed the government. In 2015, RJD wrested the seat from the BJP and the RJD-JDU Congress formed the government. In 2020, the seat went to the BJP again and the NDA formed the government. The seat is currently represented by BJP's Murari Mohan Jha. Jha is pitted against RJD candidate Faraz Fatmi.

Haryana Cong's 'Vote Chori' Stir Tests Unity After Poll Defeat

CL Manoj

New Delhi: Congress circles are closely watching how the agitation by the Haryana Congress leadership which started from Wednesday to fan the 'vote-chori' allegation levelled by Rahul Gandhi in last year's state assembly election will play out. The signals emerged from a meeting convened at the Congress headquarters here last Sunday to plan the agitation, and the line-up witnessed at the first two days' ground-show at Karnal and Ambala, respectively, has made many in the party debate whether the agitation will help unite the state party post-defeat or whether it will end up sharpening the factional fault-lines.

The Delhi meeting, convened by AICC in-charge BK Hariprasad to plan the agitation, sources said, saw major turnout by supporters of Bhupinder Singh Hooda, freshly re-elected Congress Legislature Party leader. Some participants said, while Hooda, with new PCC president Rao Narendra Singh in tow, exhorted participants to make the agitation a huge success, his in-house rival and AICC general secretary Kumar Selja spoke mostly about the 'vote-chori' issues being raised by Gandhi whereas other senior factional state party leaders such as Randeep Surjewala, Birender Singh and Ajay Yadav didn't turn up "due to pre-occupation".

Saharsa seat is another bellwether seat. Presently, the seat is held by BJP's sitting MLA Alok Ranjan Jha. Jha is contesting once again against Indrajit Gupta of BJP.

Sakra assembly seat in Muzaffarpur district is another seat which comes close to being a bellwether seat. Sakra had gone wrong only once since 1977. In 1985, Shivnandan Paswan of Lokdal won the seat while Congress formed the state government. Barring 1985, the seat has followed the bellwether pattern. At present, JDU holds the seat.

Munger assembly seat had gone wrong once in 1985 when a Lokdal candidate won the seat, and Congress formed the government. Munger is currently represented by Pranay Kumar Yadav of BJP.

Pipra in East Champaran is another seat which has gone wrong only once in 2015. In 2015, Shyamababu Prasad Yadav of BJP won the seat while MGRS, led by Nitish Kumar, formed the government. Yadav is the sitting MLA from the seat and is contesting elections against Rajmangal Prasad of CPI(M).

Barbigha in Nawada district is another seat which comes close to Pipra. The seat was won by the Janata Party in 1977 and then by Congress till 2000. In 2000, Congress became part of the RJD government in the state. In 2015, the seat was won by Sudarshan Kumar of Congress and in 2020 Kumar won on a JDU ticket.



DRUGS AND CHEMICALS LIMITED

PAR DRUGS AND CHEMICALS LIMITED

CIN: L24117GJ1999PLC035512

Registered office: 815, Nilamber Triumph, Gotri Vastu Road, Vadodra-390007, Gujarat, India

Phone no.: 0265-2991021, 0265-2991022

Website: www.pardrugs.com Email: investors@pardrugs.com

Statement of Standalone Un-Audited Financial Result for the Quarter & Half-year Ended 30th September, 2025

(Rs. in Lakh except per share data)

Sr. No.	Particulars	Quarter Ending			Half Year ended		Year ended
		30.09.2025	30.06.2025	30.09.2024	30.09.2025	30.09.2025	31.03.2025
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	2,865.89	2,604.64	3,465.69	5,470.53	5,726.25	10,097.35
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	555.02	447.78	1,148.69	1,002.80	1,487.19	1,792.29
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	555.02	447.78	1,148.69	1,002.80	1,487.19	1,792.29
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	412.96	332.81	859.58	745.77	1,112.89	1,335.79
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	412.96	332.81	859.58	745.77	1,112.89	1,335.79
6	Equity Share Capital (Face Value per share Rs. 10/-)	1,230.46	1,230.46	1,230.46	1,230.46	1,230.46	1,230.46
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	8,667.03
8	Earnings Per Share of Rs. 10/- Each (for discontinued & continuing operation) Basic as well as Diluted	3.36	2.70	6.99	6.06	9.04	10.86

Note: (a) The result have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting held on 13/11/2025. (b) The above is an extract of the detailed format of Statement of Unaudited Financial Result for the Quarter and half year ended 30th September, 2025 filed with the National Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and half year ended 30th September, 2025 are available on the website viz <https://www.nseindia.com/> and the website of the Company at www.pardrugs.com (c) # Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable. (d) The Company is primarily engaged in manufacturing of API, which constitute single business segment in terms of Ind AS - 108 on 'Operating Segments'. Accordingly, there is no separate reportable segments as per Ind AS - 108. (e) The Company does not have any subsidiary, associates or joint venture as on 30th September, 2025; therefore, it has prepared only standalone results as consolidation requirement is not applicable to the Company.

Date: 13/11/2025
Place: Vadodra

For & on Behalf of the Board
Par Drugs And Chemicals Limited
Sd/-
(Mr. Falgun V. Savani)
Managing Director
DIN: 00198236

ACQUISITION

A well known Corporate group is looking for acquisition of Running NBFC Company.

NBFC Companies having valid RBI Licenses and accepting Non-public deposit with no credit default status and investment business interested in selling can apply within 7 days.

senjoe49@gmail.com

ReNew¹⁵

**₹82,000 CRORE PLEDGE TODAY.
FOR A CLEANER, GREENER TOMORROW.**

ReNew has been a proud partner in the clean energy journey of the **Sunrise State, Andhra Pradesh**, for over a decade. As we celebrate **15 years of Energy. Impact. Transformation**, our expanding portfolio of projects continues to energize the state's green future.

Signing MoUs for four clean energy projects at the CII Partnership Summit 2025, we are advancing the state's sustainable progress and enabling over 10,000 direct/indirect job opportunities.




ReNew

OUR DECARBONISATION SOLUTIONS:

Solar | Wind | Hydro | Solar Module & Cell Manufacturing
Green Hydrogen | Energy Storage | Energy Services | Green Credits

*The groundbreaking ceremony for 4.8 GWp hybrid site took place on May 16, 2025.

<div>  MADHAV COPPER LIMITED </div>						
Registered Office : Plot 2107/D, 203, 2 nd Floor, D & I Excelus, Opp. Home School, Waghawadi Road, Bhavnagar- 364 001. Contact : + 91 278 3001034, 2564765 E-mail : mcopper2013@gmail.com Website: www.madhavcopper.com						
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2025						
(Rs in lakhs)						
Sr. No.	Particulars	Standalone				
		Quarter Ended		Half Year ended		Year ended
		30.09.2025 (Un-Audited)	31.09.2024 (Un-Audited)	30.09.2025 (Un-Audited)	31.09.2024 (Un-Audited)	31.03.2025 (Audited)
1	Total Income from Operations	5147.58	2588.99	9784.69	5047.33	12539.31
2	Net P/L for the period (before tax, exceptional and/or extraordinary item)	110.81	91.71	213.66	207.61	345.39
3	Net P/L for the period (before tax, after exceptional and/or extraordinary item)	110.81	91.71	213.66	207.61	345.39
4	Net P/L for the period tax (after exceptional &/or exceptional items)	-20.38	95.43	83.88	206.44	345.39
5	Total Comprehensive income for the period [Comprising Profit(loss) for the period (after tax) & other comprehensive income (after tax)]	-20.38	95.43	83.88	206.44	468.77
6	Equity share capital (FV of Rs 5 each)	1357.14	1357.14	1357.14	1357.14	1357.14
7	EPS(of RS 5 each) (not annualised) Basic and Diluted)	-0.08	0.35	0.31	0.76	1.73